

# Psa

## Chapter 86

Gujarati Interlinear

Reference: American Standard Version

1	תְּפִלָּה પ્રાર્થના H8605	לְרוּךְ દાવિદની H1732	הַטָּהַר નમાવો H5186	יְהוָה યહોવાહ H3068	אֲזַנְךָ તમારો-કાન H0241	עֲנֵנִי ઉત્તર-આપો-મને H0935	כִּי- કારણ-કે H0358	עָנִי ગરીબ H6041	וְאֲבִינוּן અને-જરૂરિયાતમંદ H0034	אֲנִי: હું-હું H0589
2	שְׁמֹרָה સાચવી H8104	נַפְשִׁי મારો-આત્મા H5315	כִּי- કારણ-કે H0358	חָסִיד ભક્ત H2623	אֲנִי હું-હું H0589	הוֹשִׁעַ બચાવો H3467	עֲבֹדָךָ તમારે-સેવકને H5650	אֱתָה તમે H0358	אֱלֹהֵי મારે-ઈશ્વર H0430	הַבּוֹטָח ભરોસો-રાખનારો H0982
	אֱלֹהֵי: તમારેમાં H0413									
3	חַנּוּן કૃપા-કરો H0136	אֲדֹנָי હે-પ્રભુ H0136	כִּי- કારણ-કે H0358	אֱלֹהֵי તમને H0413	אֶקְרָא બોલાવું-હું H7121	כָּל- આખો H3605	הַיּוֹם: દિવસ H3117			
4	שִׁמְחָה આનંદિત-કરો H8055	נַפְשִׁי આત્મા H5315	עֲבֹדָךָ તમારે-સેવકનો H5650	כִּי- કારણ-કે H0358	אֱלֹהֵי તમારે-તરફ H0413	אֲדֹנָי હે-પ્રભુ H0136	נַפְשִׁי મારો-આત્મા H5315	אֶשָּׂא: ઉંચકું-હું H5375		
5	כִּי- કારણ-કે H0358	אֱתָה તમે H0358	אֲדֹנָי હે-પ્રભુ H0136	טוֹב સારા H0358	וְסִלַּח અને-ક્ષમાશીલ H5546	וְרַב- અને-પુષ્કળ H0358	חָסֵד કૃપામાં H0358	לְכֹל- બધા-માટે H3605	קְרִיאָי: બોલાવનારાઓને H7121	
6	הַאֲזִינָה કાન-ધરો H0238	יְהוָה હે-યહોવાહ H3068	תְּפִלָּתִי મારી-પ્રાર્થના H8605	וְהִקְשִׁיבָה અને-ધ્યાન-આપો H7181	בְּקוֹל અવાજ H0358	תְּחַנּוּנֹתַי: મારી-વિનંતીઓનો H8469				
7	בְּיָסֵד દિવસે H3117	אֶרְתִּי મારી-વિપત્તિને H0358	אֶקְרָא બોલાવીશ H7121	כִּי- કારણ-કે H0358	תַּעֲנֵנִי: ઉત્તર-આપશો H0935					
8	אֵין- કોઈ-નહીં H0369	כְּמוֹת તમારે-જેવો H3644	וּבְאֵלֵהֶם ઈશ્વરોમાં H0430	אֲדֹנָי હે-પ્રભુ H0136	וְאֵין અને-કોઈ-નહીં H0369	כְּמוֹעֵי: તમારે-કાર્યો-જેવા H4639				
9	כָּל- બધી H3605	אֲנִים પ્રજાઓ H0358	אֲשֶׁר જે H0358	עָשִׂיתָ તમે-બનાવી H0935	וּבְאוֹ આવશે H0935	וַיִּשְׁתַּחֲוּ અને-પૂજા-કરશે H7812	לְפָנֶיךָ તમારી-આગળ H6440	אֲדֹנָי હે-પ્રભુ H0136	וַיִּכְבְּדוּ અને-મહિમા-આપશે H3513	
	לְשֹׁמְרֵי: તમારે-નામને H8034									
10	כִּי- કારણ-કે H0358	גְּדוֹל મહાન H0358	אֱתָה છો-તમે H0358	וְעִשָּׂה અને-કરનાર H0358	נִפְלְאוֹת અમત્કારો H6381	אֱתָה તમે H0358	אֱלֹהִים ઈશ્વર H0430	לְבַדְּךָ: એકલ H0905		
11	הִתְרַנְּנִי શીખવાડો-મને H0368	וְהַתְּהַר યહોવાહ H3068	הַרְבֵּךְ તમારો-માર્ગ H1870	אֶתְלִישׁ ચાલીશ H1980	בְּאֵמֶת તમારે-સત્યમાં H0571	יְתַד એક-કરો H3161	לְבָבִי મારું-હૃદય H3824	לִירְאָה ડરવા H3372	שִׁמְרֵי: તમારે-નામથી H8034	

12      אֲוֹרָה    אֲדָנִי    אֱלֹהֵי    בְּכֹל-    לִבִּי    וְאֶכְבְּדָה    שְׁמִי    לְעֹלָם:  
 હું-આભાર-માનીશ    હે-પ્રભુ    મારે-ઈશ્વર    બધ    હૃદયથી    અને-મહિમા-આપીશ    તમારે-નામને    સદા-માટે  
[H3034](#)    [H0136](#)    [H0430](#)    [H3605](#)    [H3824](#)    [H3513](#)    [H8034](#)    [H5769](#)

13      כִּי-    קִסְדָּךְ    נְדָוָל    עָלַי    וְהִצַּלְתָּ    נַפְשִׁי    מִשָּׂאוֹל    תַּחֲתֶיךָ:  
 કારણ-કે    તમારી-કૃપા    મહાન-છે    મારે-ઉપર    અને-છોડાવ્યો    મારો-આત્મા    અધોલોકમાંથી    ઊંડાણમાંથી  
[H0430](#)    [H0136](#)    [H0430](#)    [H3605](#)    [H3824](#)    [H3513](#)    [H7585](#)    [H8482](#)

14      אֱלֹהִים    אֱדִים    קָמוּ-    עָלַי    וְעַד    עֲרִיצִים    בְּקִשׁוֹ    נַפְשִׁי    וְלֹא  
 હે-ઈશ્વર    અભિમાનીઓ    ઊઠ્યા-છે    મારી-વિરુદ્ધ    અને-ટોળું    જીલમીઓનું    શીઘે-છે    મારો-આત્મા    અને-નહીં  
[H0430](#)    [H2086](#)    [H0430](#)    [H3605](#)    [H5712](#)    [H6184](#)    [H1245](#)    [H5315](#)    [H3808](#)

שְׁמוֹנִי    לְנִגְדֶם:  
 મૂક્ય-છે-તમને    તેમની-આગળ  
[H5048](#)

15      וְאַתָּה    אֲדָנִי    אֱלֹ-    רַחֲמִים    וְחַנּוּן    אֲרָךְ    אֲפִים    וְרַב-    קֶסֶד    וְאַמֶּת:  
 પણ-તમે    હે-પ્રભુ    ઈશ્વર    કરુણાળુ    અને-કૃપાળુ    ધીરજ    ક્રોધમાં    અને-પુષ્કળ    ફૂપામાં    અને-સત્યમાં  
[H0136](#)    [H0410](#)    [H7349](#)    [H2587](#)    [H0750](#)    [H0639](#)    [H0571](#)

16      כָּנָה    אֱלֹי    וְחַנּוּנִי    תַּנְה-    עֲזָרָה    לְעַבְדְּךָ    וְהוֹשִׁיעָה    לְבִנְךָ    אֲמִתָּה:  
 ફરો    મારી-તરફ    અને-કૃપા-કરો    આપો    તમારું-બળ    તમારે-સેવકને    અને-બચાવો    પુત્રને    તમારી-દાસીનો  
[H6437](#)    [H0413](#)    [H5414](#)    [H5797](#)    [H5650](#)    [H3467](#)    [H0519](#)

17      עֲשֵׂה-    עָמִי    אֹת    לְטוֹבָה    וְיִרְאוּ    שְׂנְאָי    וַיְבַשּׁוּ    כִּי-    אַתָּה    יְהוָה  
 બતાવો    મારી-સાથે    યિહ    સારાનું    અને-જુએ    મારે-ધિક્કારનારે    અને-શરમિદે-થાઓ    કારણ-કે    તમે    યહોવાહ  
[H0226](#)    [H7200](#)    [H8130](#)    [H0954](#)    [H3068](#)

וְנַחֲמֶנִי:  
 અને-દિવાસો-આપ્યો    મદદ-કરી  
[H5162](#)    [H5826](#)